

Seat No. : _____

MJ-107

July-2021

B.Sc., Sem.-I

CC-101 : Chemistry (General Chemistry)

Time : 2 Hours]

[Max. Marks : 50

- સૂચના : (1) વિભાગ-Iના બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.
(2) વિભાગ-I માંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના જવાબ આપો.
(3) વિભાગ-IIના પ્રશ્ન નં. 9 ફરજિયાત છે.

વિભાગ - I

1. (A) લેન્થેનાઈડ શ્રેણીના તત્ત્વોના નામ, સંજા અને ઈલેક્ટ્રોનીય રચના આપો. 7
(B) ઈલેક્ટ્રોનીય રચનાને આધારે લેન્થેનાઈડ તત્ત્વોની જુદી-જુદી ઓ.સ્થિતિઓ સમજાવો. 7
2. (A) એક્ટેનાઈડ શ્રેણીના તત્ત્વોના નામ, સંજા, પ્ર.કમાંક અને ઈલેક્ટ્રોનીય રચના આપો. 7
(B) એક્ટેનાઈડ તત્ત્વોની ઓક્સિડેશન સ્થિતિઓ તથા તેમના રંગ સમજાવો. 7
3. (A) નાઈટ્રોજનના પરિમાપનની જેલહાત પદ્ધતિ સમજાવો. 7
(B) કાર્બનિક એસિડનો આગુભાર શોધવાની સિલ્વર ક્ષાર પદ્ધતિ ચર્ચો. 7
4. (A) સહસંચોજક બંધના જુદા-જુદા વિભાજન ચર્ચો. 7
(B) બેન્જિનમાં ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સમજાવો. 7
5. (A) આલ્કેનની બનાવટ વુર્દુજ પ્રક્રિયાની મદદથી ડિયાવિધી સાથે ચર્ચો. 7
(B) પ્રોપીનનું ઉદાહરણ લઈ માર્કોફનિકોફનો નિયમ સમજાવો. 7
6. (A) આલ્કાઈનની હાઇડ્રોશન, ઓઝોનીકરણ અને પોલિમરાઈઝેશન પ્રક્રિયાઓ સમજાવો. 7
(B) (i) એસિટિલીનમાંથી એસિટાફીલીડીની બનાવો.
(ii) આલ્કીલ હેલાઈડની ધાતુ એસિટીલાઈડ સાથેની પ્રક્રિયા ચર્ચો. 7

7. (A) થમોડાઇનેમિક્સનો શૂન્યનો નિયમ ચર્ચો. 7
એક એન્જિન 112°C અને 27°C વચ્ચે કાર્ય કરતું હોય તો તેની કાર્યક્ષમતા ગણો.
- (B) આદર્શ વાયુ માટે અચળ તાપમાને એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ તારવો. 7
8. (A) પ્રક્રિયકોની સાંક્રતા સમાન ન હોય ($a \neq b$) ત્યારે દ્વિત્યક્ષમની પ્રક્રિયા માટેનું સમીકરણ મેળવો. 7
(B) પ્રથમક્ષમની પ્રક્રિયાના સમીકરણનો ઉપયોગ કરી $t_{1/2}$ નું સૂત્ર તારવો. એક પ્રથમક્ષમની પ્રક્રિયાને 40%
પૂર્ણ થવા માટે 1600 સેકન્ડનો સમય લાગે છે. 60% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ? 7

વિભાગ – II

9. ટૂકમાં જવાબ આપો : (ગમે તે આઠ) 8
(1) 63 પ. કમાંક ધરાવતા એકેટનાઈડ તત્ત્વની ઈલેક્ટ્રોન રચના લખો.
(2) પ્રથમ સંકાંતિ શ્રેણી કોણ રચે છે ? લેન્થેનાઈડ કે એક્ઝિનાઈડ.
(3) Np તત્ત્વનું નામ લખો.
(4) પ્લુટોનિયમ તત્ત્વની ઈલેક્ટ્રોનીથ રચના લખો.
(5) એસ્ટિનો આગુભાર શોધવાની પદ્ધતિ જણાવો.
(6) સમવિભાજન એટલે શું ?
(7) નીચો પેન્ટેનનું બંધારણ ઢોરો.
(8) પ્રક્રિયા પૂર્ણ કરો : $\text{CH}_3 - \text{CH} = \text{CH}_2 + \text{HBr} \xrightarrow{\text{H}_2\text{O}_2}$
(9) કોઈપણ બે તટસ્થ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો જણાવો.
(10) $\text{S}_{\text{N}}1$ કિયાવિધીમાં આલ્કાઈલ હેલાઈડની કિયાશીલતાનો કમ જણાવો.
(11) ઈથાઈનું ઓઝોનીકરણ કરતાં મળતી નિપજનું નામ લખો.
(12) વિનાઈલ ક્લોરાઈડનું બંધારણ આપો.
(13) થમોડાઇનેમિક્સનો પ્રથમ નિયમ આપો.
(14) પ્રક્રિયાનો દર એટલે શું ?
(15) એન્ટ્રોપી ક્યા પ્રકારનું વિધેય છે ?
(16) દ્વિત્યક્ષમની પ્રક્રિયા એટલે શું ?
-

Seat No. : _____

MJ-107

July-2021

B.Sc., Sem.-I

**CC-101 : Chemistry
(General Chemistry)**

Time : 2 Hours]

[Max. Marks : 50

- Instructions :**
- (1) All Questions in **Section I** carry equal marks.
 - (2) Attempt any **THREE** questions in **Section I**.
 - (3) Question IX in **Section II** is **COMPULSORY**.

Section – I

1. (A) Give names, symbols and electronic configuration of Lanthanide elements. 7
(B) On the basis of electronic configuration explain various oxidation states of Lanthanides. 7

2. (A) Give names, symbols of atomic numbers and electronic configuration of actinides. 7
(B) Explain the oxidation states and colour of Actinide elements. 7

3. (A) Explain Kjeldahl's method for nitrogen estimation. 7
(B) Explain the silver salt method for the determination of molecular weight of an organic acid. 7

4. (A) Discuss the various types of fission of covalent bonds. 7
(B) Explain the electrophilic substitution reaction in benzene. 7

5. (A) Explain the preparation of Alkane by Wurtz's method with mechanism. 7
(B) Explain the Markownikoff rules with example of propene. 7

6. (A) Explain hydration, ozonalysis and polymerization reaction in alkyne. 7
(B) (i) Prepare Acetaldehyde from Acetylene.
(ii) Explain the reaction of metal acetylides with alkyl halides. 7

7. (A) Explain the zeroth law of thermodynamics. Calculate the efficiency of an engine operating between 112 °C and 27 °C. 7
- (B) Derive the equation for an ideal gas for its change in entropy at constant temp. 7
8. (A) Derive the equation for second order reaction when concentration of both reactants ($a \neq b$) are different. 7
- (B) Derive the equation of $t_{1/2}$ for first order with uses of first order reaction equation.
A first order reaction is completed 40% in 1600 seconds. How much time is required for completion of 60%. 7

Section – II

9. Answer in short : (any eight) 8
- (1) Write electronic configuration of actinide elements having atomic number 63.
 - (2) Which series create first inner transition series ? Lanthanide or Actinide.
 - (3) Give the name of Np element.
 - (4) Write the electronic configuration of plutonium.
 - (5) Give the name of method for determining molecular weight of acid.
 - (6) What is Homolytic fission ?
 - (7) Draw the structure of neopentane.
 - (8) Complete the equation :
- $$\text{CH}_3 - \text{CH} = \text{CH}_2 + \text{HBr} \xrightarrow{\text{H}_2\text{O}_2}$$
- (9) Give any two examples of Neutral nucleophilic reagents.
 - (10) Give the order of reactivity of alkyl halides in $\text{S}_{\text{N}}1$ mechanism.
 - (11) Give the name of the product of ozonization of ethyne.
 - (12) Draw the structure for vinyl chloride.
 - (13) State the first law of thermodynamics.
 - (14) What is rate of reaction ?
 - (15) What kind of function Entropy is ?
 - (16) What is second order reaction ?
-